

ત્વરિત જાહેરાત માટે

બ્રમ્પટન સીટી કાઉન્સિલે કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન રિડક્શન પ્લાનને સર્વાનુમતે સમર્થન આપ્યું

બ્રમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 23, 2020) – આજે કાઉન્સિલની કમિટીની બેઠકમાં, બ્રમ્પટન સીટી કાઉન્સિલના સભ્યોએ વર્ષ 2050 સુધીમાં બ્રમ્પટનમાં ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન 80 ટકા સુધી ઘટાડવાના સીટીના લક્ષ્ય માટે એક નોંધપાત્ર પગલું ભરવા તેઓએ સીટીના પ્રથમ કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન રિડક્શન પ્લાન (CEERP) ને સમર્થન આપ્યું.

શેરિડેન કોલેજ સાથેની ભાગીદારીમાં CEERP વિકસાવવાથી, તે શહેર, રહેવાસીઓ અને ધંધાઓ માટે ઊર્જા કાર્યક્ષમતા સુધારવા નવી શ્રેષ્ઠ પ્રથાઓ વિકસાવવા અને સ્વીકારવા, GHGs ઘટાડવા, ઊર્જા સુરક્ષાની ખાતરી કરવા, આર્થિક લાભ કમાવવા અને આબોહવામાં ફેરફાર સામે સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદરૂપ થવા એક માર્ગદર્શિકા તરીકે કાર્ય કરશે. ખાસ કરીને, CEERP નાં ત્રણ લક્ષ્યો છે:

- વર્ષ 2041 સુધીમાં સમગ્ર સમુદાય દ્વારા ઊર્જાનો અંતિમ વપરાશ વર્ષ 2016 નાં સ્તરોએથી ઓછામાં ઓછો 50 ટકા ઘટાડવો
- વર્ષ 2041 સુધીમાં સમગ્ર સમુદાય દ્વારા ઉત્સર્જન વર્ષ 2016 નાં સ્તરોએથી ઓછામાં ઓછું 50 ટકા જેટલું ઘટાડવું, અને ફેડરલ કે પ્રોવિન્સિયલ લક્ષ્યાંકોને પહોંચી વળવા કે વટાવી જવા વર્ષ 2050 માં ઓછામાં ઓછું 80 ટકા જેટલું ઉત્સર્જન ઘટાડવાનો માર્ગ સ્થાપિત કરવો.
- વર્ષ 2041 સુધીમાં સમુદાયમાં સંચયિત ઊર્જા ખર્ચાઓમાં ઓછામાં ઓછાં \$26 બિલિયન પોતાની પાસે રાખવા.

સીટી સાત વ્યૂહાત્મક નિર્દેશો મારફતે આ ત્રણ લક્ષ્યોને પહોંચી વળશે. દરેક વ્યૂહાત્મક નિર્દેશમાં શ્રેણીબદ્ધ હેતુઓ હોય છે અને વર્ષ 2041 નો લક્ષ્યાંક શહેર અને સામુદાયિક કામગીરીઓને નિર્દેશ કરશે. બ્રમ્પટનના ઊર્જા પરિવર્તનને વેગ આપવા, CEERP દ્વારા છ અગ્રતા પ્રોજેક્ટ્સ ઓળખવામાં આવ્યા છે જે આગામી પાંચ વર્ષોમાં પૂરા કરવાના રહે છે. અગ્રતા પ્રોજેક્ટ્સ ઉપરાંત, પ્લાનના હેતુઓ અને લક્ષ્યાંકોને પહોંચી વળવા CEERP દ્વારા આગામી 20 ઉપરાંત વર્ષોમાં સંખ્યાબંધ કાર્યવાહીઓની રૂપરેખા બનાવાઈ છે. આ કાર્યવાહીઓ ચાલુ, ટૂંકા, મધ્યમ કે લાંબા-ગાળાની તરીકે ઓળખી કાઢી છે, અને તે નિયમિતપણે અદ્યતન કરવામાં આવશે.

CEERP પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/ceerp

ઝડપી હકીકતો

- વર્ષ 2019 માં, બ્રમ્પટન સીટી કાઉન્સિલે શહેરમાં ઉત્પન્ન થતું GHGs ઉત્સર્જન વર્ષ 2050 સુધીમાં 80 ટકા જેટલું ઘટાડવાનો હેતુ ધરાવીને આબોહવામાં કટોકટીની ઘોષણા કરવા સર્વસંમતિ દર્શાવતો મત આપ્યો હતો.
- CEERP કમ્યુનિટી ટાર્ક ફોર્સ, ઉદ્યોગ અને સામુદાયિક આગેવાનોના જૂથે પ્લાન વિકસાવવા સહયોગ સાધ્યો હતો.
- ફેબ્રુઆરીમાં, વન મિલિયન ટ્રીઝ પ્રોગ્રામના ભાગરૂપે, બ્રમ્પટન સીટી કાઉન્સિલે સમગ્ર શહેરમાં દર વર્ષે 50,000 નવા વૃક્ષો રોપવાને સમર્થન આપ્યું. આ આબોહવામાં ફેરફારના ભયનો સામનો કરવા માટે અન્ય એક મોટું પગલું છે.
- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) આબોહવામાં ફેરફાર સામે લડત આપવામાં અગ્રણી 9,200 થી વધારે શહેરોમાં પોતાના જેવું પ્રથમ વૈશ્વિક જોડાણ ધરાવતી, ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જી નામક સંસ્થાના સભ્ય છે.
- સીટી ઓફ બ્રમ્પટન પીલ ક્લાઈમેટ ચેન્જ પાર્ટનરશિપના સભ્ય છે, જે રીજીયન ઓફ પીલ અને સ્થાનિક મ્યુનિસિપાલિટીસ વચ્ચેના સહયોગમાં છે જે પ્રોજેક્ટ્સ પર અને ભંડોળ સુરક્ષિત કરવા સાથે મળીને કામ કરે છે જેનાથી દરેક સભ્ય સંસ્થાને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં અને આબોહવામાં ફેરફારને અનુકૂળ થવામાં મદદ મળશે.

કવોટ્સ (અવતરણો)

“કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન રિડક્શન પ્લાન ટકાઉ, ગ્રીન સીટી બનવાના આપણાં માર્ગમાં અન્ય એક નોંધપાત્ર પગલું છે. તેનાથી ન કેવળ વર્ષ 2050 સુધીમાં બ્રેમ્પટનમાં 80 ટકા જેટલું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના આપણાં લક્ષ્યને પહોંચી વળવામાં મદદ મળશે, પરંતુ તે બ્રેમ્પટન આબોહવા કટોકટી સામે આપણી લડત લડવામાં મ્યુનિસિપલ આગેવાન હોવાનું પણ બતાવે છે. આપણે સૌએ આબોહવામાં ફેરફારના ભયનો સામનો સાથે મળીને કરવાનું ચાલુ રાખવું રહ્યું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“કેનેડામાં મ્યુનિસિપાલિટીસ લગભગ અર્ધોઅર્ધ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે જવાબદાર હોય છે. કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન રિડક્શન પ્લાન બ્રેમ્પટનની ગ્રીન સીટી બનવાની કટિબદ્ધતાનું સ્પષ્ટ ઉદાહરણ છે, અને મને વિશ્વાસ છે કે તે ઊર્જા કાર્યક્ષમતા સુધારવા, GHGs ઘટાડવા અને આબોહવા ફેરફાર સામે સ્થિતિસ્થાપકતા વધારવા આપણાં સમર્પણમાં ઉપયોગી થશે.”

પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5, અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા, આપણે આ ઘોષિત આબોહવા કટોકટી દરમિયાન સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવું રહ્યું. CEERP કમ્યુનિટી ટાર્ક ફોર્સના ભાગરૂપે સહયોગ સાધનાર આપ સૌનો, અને કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન રિડક્શન પ્લાન વિશે વધુ માહિતી મેળવવા પ્રવૃત્તિ સત્રોમાં હાજર રહેનાર રહેવાસીઓનો આભાર. આપણી ગ્રીન સીટી બનાવવાની કામગીરી ચાલુ છે ત્યારે તે ટકાઉપણું સામે આપણાં પ્રવાસ પર અનિવાર્ય રોડમેપ તરીકે ઉપયોગી બનશે.”

- ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, સભ્ય, CEERP કમ્યુનિટી ટાર્ક ફોર્સ, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણે બ્રેમ્પટનને ગ્રીન સીટી બનાવવાની અગ્રતા તરફ કામ કરવાનું ચાલુ રાખીએ છીએ અને વર્ષ 2050 સુધીમાં આપણાં સમુદાયમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન 80 ટકા સુધી ઘટાડવાના કાઉન્સિલના લક્ષ્યને પહોંચી વળવા પ્રયત્નશીલ છીએ ત્યારે, શેરિડેન સાથેની ભાગીદારીમાં વિકસાવાતા, કમ્યુનિટી એનર્જી એન્ડ એમિશન રિડક્શન પ્લાનથી કર્મચારીઓને માર્ગદર્શન મળશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એન્જેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca